



Date: 06/09/2024

To,
Listing Compliance Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block G,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Dear Sir/Ma'am,

Sub: Newspaper publication of Notice of the Annual General Meeting ("AGM") of the Company

Ref: Pattech Fitwell Tube Components Limited (Symbol: PATTECH)

Pursuant to the provisions of Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Notice of the 2nd Annual General Meeting ("AGM") of the Company to be held on September 28, 2024, cut-off date and e-voting schedule which was published in "Free Press Gujarat" (English) and "Lokmitra" (Gujarati) newspaper dated 6th September, 2024.

Request you to please take the same on your records.

Thanking you,

Yours faithfully,

**For, Pattech Fitwell Tube Components Limited
(Erstwhile Pattech Fitwell Tube Components)**



Bharatbhai Limbani
Chairman and Managing Director
DIN: 09710373

Place: Vadodara

PATTECH FITWELL TUBE COMPONENTS LIMITED
(ERSTWHILE PATTECH FITWELL TUBE COMPONENTS)

CIN: U28990GJ2022PLC134839

Registered Office: Survey No. 873/B/1, Road No.: 1, Ansons Limbani Estate,
Near GETCO 66 K.V. Sub Station, G.I.D.C, Por, N.H-08, Dist.: Vadodara - 391243, Gujarat, India

E-mail ID: tubefitwell@gmail.com; **Contact No:** +91 265 283 0151, +91 98986 95369

Balochistan's Balochistan is the engine of the nation's development

accelerate its action. Balochistan is a rugged terrain. The mountainous landscape complicates the scope of the counter-offensive. Because of the prolonged insurgency, there are several pockets in Balochistan that the Pakistani Army cannot penetrate.

The usual tactics of divide and rule of the ISI and Pakistan Army will not work this time. The game of factionalism does not seem to work anymore. The current insurgency is far more coordinated and sharply focused. The political and insurgent factions are in tandem and reinforce each other. This combination is the most lethal. The soft and hard

methods are engaged to amplify the gravity of demands for autonomy and sovereignty.

In the past, Pakistan mismanaged the Baloch problem. Repression became its tool of control. It galvanised the Baloch resentment into full-fledged insurgency. Pakistan undertook a host of measures, both covert and overt, to douse the flame of Baloch liberation. The covert includes forced disappearances, human rights abuses, population mixing, Islamic indoctrination, profiling the protesters, espionage, intensifying military depth, appointing Pakistani stooge in the Baloch affairs, etc. The

ground. Moreover, Chinese interventionism in the region was achieved through its robust China-Pakistan Economic Corridor (CPEC), launched in April 2015. The CPEC project passes through

the heart of Balochistan, connecting the Xinjiang Uygur Autonomous Region in China and the deep-sea Pakistani ports of Gwadar and Karachi. It also passes through the Pak-occupied Jammu and Kashmir (PoJK), a disputed area. The CPEC is to drain the natural resources of Balochistan.

Route aspirations. The Chinese CPEC has also contributed to the intensification of the Baloch insurgency. The resource-rich Balochistan has attracted Chinese attention. A perception prevails among the Baloch that China's ulterior motive behind the CPEC is to drain the natural resources of Balochistan.

Is Pakistan imploding? It is quite likely. Nothing threatens Pakistan as the current Baloch uprising. The Baloch insurgency against the Pakistani state has been a recurrent phenomenon since it acceded to Pakistan on March 27, 1948. Mir Ahmad Yar Khan, Ahmadzai, the ruler of Kalat, signed the instrument of accession. This was done with the application of force by the Pakistani Army. It was force, not volition, that determined the merger.

The synthetic merger without consent became the bone of contention between the Pakistani state and Balochistan. The Khan of Kalat demanded Independence for Balochistan. The British apprehensions of Soviet expansion wrapped up the matter, giving Pakistan leverage to determine its territory. The repressive state apparatus unleashed enormously upon the Baloch people to quell their cry for independence. Insurgencies, therefore, became a routine. Five waves of insurgency took place in Balochistan in 1948, 1958-59, 1962-63, 1973-1977 and 2003 till date.

The Baloch are a proud people who love their land, language, and ethnicity. They never accepted the subservience to Pakistani Punjabi dominance. Despite being the Sunni Muslim, the Baloch language and ethnicity always gave them a distinct identity. However, territorially, Balochistan is the largest province, constituting almost 43.6 per cent of Pakistan's area and located in the southwestern region of the country. Since its unwilling annexation, it has suffered immensely because of forced disappearances, killings, neglect, torture,

AKASH INFRA-PROJECTS LIMITED
CIN: L28091399930360
Regd. Office: 2, GROUND FLOOR, ABHISHEK COMPLEX, OPP. HOTEL HAVELI, SECTOR-11, GANDHINAGAR - 382011, GUJARAT
Ph. No.: +91-79-23227000
Website: www.akashinfra.com, E-Mail: info@akashinfra.com

NOTICE
The Company hereby gives that the 25th Annual General Meeting (AGM) of Akash Infra-Projects Limited will be held on Monday, September 30, 2024 at 4:00 p.m. through Video Conferencing (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM) in compliance with the applicable provisions of the Companies Act, 2013 and in accordance with general circular issued by Ministry of Corporate Affairs (MCA) vide Circular No. 20/2020 dated 5th May 2020 and 9/2023 dated 20/03/2023 and all other relevant circulars issued by the Ministry of Corporate Affairs (collectively referred as "Circulars"), to transact the businesses set out in the Notice calling the AGM without physical presence of members at a common venue.

In compliance with above mentioned Circulars, Notice of 25th AGM and Annual Report of the Company for the FY 2023-24, have been sent through electronic mode only to those members who have registered their e-mail ID with the Company. The Notice of 25th AGM and Annual Report 2023-24 are also available on the Company's website at www.akashinfra.com, the Stock Exchange website at www.nseindia.com or on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

INSTRUCTIONS FOR E-VOTING:
The Company hereby informs its members remote e-voting facility in compliance with the provisions of section 108 of the Companies Act, 2013 and relevant rules made thereunder and Regulation - 44 of the SEBI (LODR) Regulations, 2015. The Company has engaged NSDL as the authorized agency to provide e-voting facility to its all members.

The cut-off date to determine eligibility to cast votes by electronic voting is **Monday, September 23, 2024**, at 09:00 AM. The e-voting facility shall be open for 03 (three) days, commencing at 9:00 am on **Friday, September 27, 2024** and ending at 09:00 PM on **Sunday, September 29, 2024** (all in IST). Any member holding shares in demat mode shall not be allowed to vote again after the cut-off date. The members who attend AGM through VC/OAVM facility and had not cast their votes by electronic voting through the facility shall not be allowed to vote again after the AGM.

The members may participate in the meeting even after exercising their right to vote by electronic voting but shall not be allowed to vote again during the meeting. Detailed instruction for remote e-voting facility and voting during the AGM are forming part of the Notice of AGM.

Any person who acquires shares and becomes a member of the Company after the date of the notice and holding shares as of the cut-off date may cast their votes by following the instructions and process of e-voting as provided in the Notice of AGM.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available on the website of the Company at www.akashinfra.com or call toll free no. +91-2499 7000 or send a request Ms. Pallavi Mhatre Senior Manager, NSDL, Address: Trade World, Awing, 4th Floor, Kamala Mills Compound, Lower Panel, Mumbai - 400013 or e-mail at: evoting@nsdl.com

For Akash Infra-Projects Limited
Sd/-
Yoginkumar Patel
Managing Director (DIN : 00463335)

Date: September 5, 2024
Place: GANDHINAGAR

Hawa Engineers Limited
CIN : L2809118993019199
Registered Office: Plot No. 129, Near Kashiaram Village Mill, Narol Road, Ahmedabad, Gujarat - 382405. Email : cs@hawaengtd.com

NOTICE OF 31st ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION, CUT-OFF AND BOOK CLOSURE DATES

Notice is hereby given that the 31st Annual General Meeting (AGM) of Members of Hawa Engineers Limited will be held on Friday, 27th September, 2024 at 04:30 p.m. through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and in accordance with the applicable provisions of the Companies Act, 2013 (the "Act") and Rules framed thereunder read with general circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") for holding of Annual Meeting along with the Notice convening AGM on 04th September, 2024 through electronic mode to the Members whose email addresses are registered with the Company and/or Depositors in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs (MCA) vide Circular No. 20/2020 dated 5th May 2020 and 9/2023 dated 20/03/2023 and all other relevant circulars issued by the Ministry of Corporate Affairs (collectively referred as "Circulars"), to transact the businesses set out in the Notice calling the AGM without physical presence of members at a common venue.

The document is also hereby given that Pursuant to the Provisions of Section 91 of the Companies Act, 2013 (Act) read with the rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, the register of members and share transfer books of the Company will remain closed from Friday, 27th September, 2024 to Friday, 27th September, 2024 (both days inclusive) for the purpose of 31st AGM of the Company. Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 (Companies Act) and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI Regulations), the members are provided with the facility to cast their votes on all resolutions set out in the Notice convening the AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in their paid-up equity share capital of the Company as on Friday, 20th September, 2024 (cut-off date).

The remote e-voting will commence on Tuesday, 24th September, 2024 at 9:00 A.M. and ends on Thursday, 26th September, 2024 at 5:00 P.M. During this period, the members of the Company holding shares either in physical form or in demat form can cast their votes on all resolutions set out in the Notice convening the AGM electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter those Members who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again during the AGM.

Any person who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@csindia.com or call toll free no. +91-2000-0991-9991. The details of the AGM are available on the website of the Company at www.hawaengtd.com CDSL at www.evotingindia.com, BSE Limited at www.bseindia.com.

Hawa Engineers Limited
Sd/-
Aslam Gajjar
Chairman, DIN: 00060978

Date: 05th September, 2024
Place: Ahmedabad

NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LIMITED
CIN: L2809021003910317991
Reg. Off: PLOT NO.119,120,SAHANI VADGAR ROAD, AT, SANTELI, TAL.KALOL, GANDHINAGAR-382721.

Notice of 32nd Annual General Meeting, Book closure and E-voting Information

Notice is hereby given that the 32nd Annual General Meeting of the Members of NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LIMITED will be held on Monday, 30th September, 2024 at 12:30 PM Video-Conferencing/ Other Audio-Visual Means (VC/OAVM) to transact the businesses set out in the Notice of AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 (Act) and Rules framed thereunder read with general circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars").

Notice convening the AGM and Annual Report of the Company for the financial year 2023-24 has been sent through electronic mode only to those Members (e-mail) to the Members who have registered their e-mail id with the Depository Participants/Company and to other Members in physical mode at their registered address.

Notice is further given that pursuant to Section 91 of the Companies Act, 2013 (Companies Act) and Rule 20 of the Companies (Management and Administration) Regulations, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24/09/2024 to 30/09/2024 (both days inclusive) for the purpose of AGM.

In terms of Section 108 of the Companies Act, 2013 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide to its members, the facility to exercise their right to vote by electronic means. The members may cast their votes on electronic voting system from 24/09/2024 to 30/09/2024. The venue of AGM (remote e-voting). The Company has entered into an agreement with National Securities Depository Limited (NSDL) to provide e-voting platform to the Members of the Company.

- All the businesses set out in the Notice of AGM may be transacted through remote e-voting.
- The remote electronic voting will commence from 27th September 2024 at 09:00 am onwards and shall end on 29th September 2024 at 5:00 pm. The members who attend the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.
- The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again during the AGM.
- A person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date (23rd September 2024) only shall be entitled to avail facility of remote e-voting or through Assent / Dissent form or voting at the AGM.
- The Notice of AGM is displayed on the website of the Company i.e. <https://www.narmadadrrip.com/> and on the website of NSDL: www.evotingindia.com.
- In case of any queries/grievances pertaining to e-voting, you may refer to frequently asked questions (FAQs) for Members and e-voting user manual available on the website of the Company at www.narmadadrrip.com/ or call toll free no. +91-2000-0991-9991. The details of the AGM are available on the website of the Company at www.narmadadrrip.com/ or call toll free no. +91-2000-0991-9991. The details of the AGM are available on the website of the Company at www.narmadadrrip.com/ or call toll free no. +91-2000-0991-9991.

By order of the Board
Sd/-
Jiten Vrajil Vachora
Whole Time Director
DIN: 02435557

PATTECH FITTUBE TUBE COMPONENTS LIMITED
CIN: U28990G2022PLC134839
Registered Office: Survey No. 873/B/1, RD No. 1, Ansons Industrial Estate NE, GETCO 66 K.V. Sub Station, G.I.D.C. Por, N.H-08 Vadodra - 391243, Gujarat, India. Phone No.: +91 265 283 0151
Website: www.pattechfittubes.com Email: cs@pattechfittubes.com

NOTICE OF THE 21st ANNUAL GENERAL MEETING OF THE COMPANY, CUT OFF DATE AND E-VOTING

NOTICE is hereby given that in accordance with the provisions of Section 91 of the Companies Act, 2013 (Companies Act) and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI Regulations), the members are provided with the facility to cast their votes on all resolutions set out in the Notice of AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in their paid-up equity share capital of the Company as on Friday, 20th September, 2024 (cut-off date).

- The remote e-voting will commence on Friday, 20th September, 2024 at 9:00 AM. The e-voting facility shall be open for 03 (three) days, commencing at 9:00 am on Friday, 20th September, 2024 and ending at 09:00 PM on Sunday, 22nd September, 2024 (all in IST). Any member holding shares in demat mode shall not be allowed to vote again after the cut-off date. The members who attend AGM through VC/OAVM facility and had not cast their votes by electronic voting through the facility shall not be allowed to vote again after the AGM.
- The members may participate in the meeting even after exercising their right to vote by electronic voting but shall not be allowed to vote again during the meeting. Detailed instruction for remote e-voting facility and voting during the AGM are forming part of the Notice of AGM.
- Any person who acquires shares and becomes a member of the Company after the date of the notice and holding shares as of the cut-off date may cast their votes by following the instructions and process of e-voting as provided in the Notice of AGM.
- In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available on the website of the Company at www.pattechfittubes.com or call toll free no. +91-265 283 0151 or send a request Ms. Anita Paul, Manager, NSDL, Address: Trade World, Awing, 4th Floor, Kamala Mills Compound, Lower Panel, Mumbai - 400013 or e-mail at: evoting@nsdl.com

For Pattech Fittube Tube Components Limited
Sd/-
Anita Paul
Company Secretary

Date: September 05, 2024
Place: Vadodra

JAY JALARAM TECHNOLOGIES LIMITED
CIN: L28022G301200C68660
Registered Office: Showroom 6, Vidcocon Arambava, Opp. Gujarat Vidyalaya, Near Navgaurkar College, Usmanpura, Ahmedabad, Gujarat - 380014, Phone No. 079 - 48995914;
Email: cs@koremobil.com Website: www.koremobil.com

NOTICE OF THE 13th ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 13th Annual General Meeting ("AGM") of the members of Jay Jalaram Technologies Limited ("the Company") will be held on Monday, 20th September, 2024 at 11:30 am, at the registered office of the Company situated at Showroom 6, Vidcocon Arambava, Opp. Gujarat Vidyalaya, Near Navgaurkar College, Usmanpura, Ahmedabad, Gujarat - 380014. The AGM shall be held through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and Rules framed thereunder read with general circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") for holding of Annual Meeting along with the Notice convening AGM on 04th September, 2024 through electronic mode to the Members whose email addresses are registered with the Company and/or Depositors in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs (collectively referred as "Circulars"), to transact the businesses set out in the Notice calling the AGM without physical presence of members at a common venue.

- The remote e-voting will commence on Friday, 20th September, 2024 at 9:00 AM. The e-voting facility shall be open for 03 (three) days, commencing at 9:00 am on Friday, 20th September, 2024 and ending at 09:00 PM on Sunday, 22nd September, 2024 (all in IST). Any member holding shares in demat mode shall not be allowed to vote again after the cut-off date. The members who attend AGM through VC/OAVM facility and had not cast their votes by electronic voting through the facility shall not be allowed to vote again after the AGM.
- The members who attend AGM through VC/OAVM facility and had not cast their votes by electronic voting through the facility shall not be allowed to vote again after the AGM.
- The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again during the AGM.
- A person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date (23rd September 2024) only shall be entitled to avail facility of remote e-voting or through Assent / Dissent form or voting at the AGM.
- The Notice of AGM is displayed on the website of the Company i.e. www.jayjalaram.com/ and on the website of NSDL: www.evotingindia.com.
- In case of any queries/grievances pertaining to e-voting, you may refer to frequently asked questions (FAQs) for Members and e-voting user manual available on the website of the Company at www.jayjalaram.com/ or call toll free no. +91-2000-0991-9991. The details of the AGM are available on the website of the Company at www.jayjalaram.com/ or call toll free no. +91-2000-0991-9991.

For Jay Jalaram Technologies Limited
Sd/-
Mukesh Prajapat
Company Secretary & Compliance Officer

Date: 05/09/2024
Place: Surat

Dev Labtech Venture Limited
(Formerly known as Dev Labtech Venture Private Limited & Jay Gems (India) Private Limited)
CIN: L36100G11993PLOC19374

Registered office: GF/22-23, Pallani Plaza, Dairy Road, Near Nilambarg Col, Bhavnagar - 364002, Gujarat, India
Phone no.: 0278-2995027 Email: cs@devlabtechventure.com
Website: www.devlabtechventure.com

NOTICE OF 31ST ANNUAL GENERAL MEETING & E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Thirty First Annual General Meeting of the Members of DEV LABTECH VENTURE LIMITED will be held on Friday, 27th Day of September, 2024 at 05.00 PM. at Hotel The Basil Park, 5, Sikon Megacity, Plot No. 129, Park, Bhavnagar - 364002, Gujarat, India to transact the business, as set out in the Notice of AGM dated 03/09/2024.

Pursuant to Section 91 of the Companies Act, 2013 (Companies Act) and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the members are provided with the facility to cast their votes on all resolutions set out in the Notice of AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in their paid-up equity share capital of the Company as on Friday, 20th September, 2024 (cut-off date).

The remote e-voting period begins on Monday, 23rd September, 2024 from 09:00 AM. IST and ends on Thursday, 26th September, 2024 at 5:00 PM. IST. During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. on Thursday, September 19, 2024 may cast their vote electronically. A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting. The remote e-voting module shall be disabled by Link Intime India Private Limited (NSDL) after the cut-off date and time. Only those shareholders who are present at the AGM and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote during the AGM through ballot/polling paper. The shareholders who have voted through Remote e-voting prior to AGM, may attend/participate but they will not be entitled to vote during the AGM. Any person who acquires shares and becomes member of the Company after the dispatch of the Notice of AGM and holds shares as on the cut-off date may obtain the User ID and Password by contacting Link Intime India Private Limited at Phone No. +91 24214916000 or Email: enotices@linkintime.co.in

In case, if you have not registered your e-mail address with the Company/Depositories/Share Transfer Agent, you may refer to frequently asked questions (FAQs) for Members and e-voting user manual available on the website of the Company at www.devlabtechventure.com/ or call toll free no. +91-2000-0991-9991. The details of the AGM are available on the website of the Company at www.devlabtechventure.com/ or call toll free no. +91-2000-0991-9991.

LOGIN TYPE	HELPSDEK DETAILS
Individual Shareholders holding securities in demat mode with NSDL	Members facing any technical issue in login can contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.com or call at : 022 - 4886 7000 and 022 - 2499 7000 (CS).
Individual Shareholders holding securities in demat mode with CDSL	Members facing any technical issue in login can contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@csindia.com or contact at toll free no. 1800 22 55 33.
Individual Shareholders holding securities in physical mode/ Institutional shareholders	Members facing any technical issue in login may contact Link Intime INSTAVOTE helpdesk by sending a request at enotices@linkintime.co.in or contact on - Tel: 022 - 4918 6000.

The details of AGM are available on website of company at www.devlabtechventure.com/; website of Link Intime India Private Limited at <https://instavote.linkintime.co.in> and website of BSE India Limited at www.bseindia.com.

FOR DEV LABTECH VENTURE LIMITED
Sd/-
Mr. Pandav Pankaj Vachani
Company Secretary & Compliance Officer

